

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ., દેવાતજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ"ની ઉજવણી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવાતજ ખાતે તા. ૦૮.૦૩.૨૦૨૧, સોમવારના રોજ "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ" ની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અલગ અલગ ગામના કુલ ૧૦૦ મહિલા ખેડૂતો તેમજ સોજીત્રા તાલુકાનાં ૧૫ આંગણવાડી ના બહેનોએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધેલ. સદર કાર્યક્રમમાં મુખ્ય મહેમાનશ્રી તરીકે મામલતદારશ્રી, સોજીત્રા તેમજ અતિથી વિશેષમાં દેવાતજ ગામના તાલુકા સભ્ય શ્રીમતી દીપીકાબેન સિસોદીયા, ઇસરામાં ગામના પ્રગતીશીલ મહિલા ખેડૂત શ્રીમતી સગુણાબેન પટેલ તથા ગાડા ગામના પ્રગતીશીલ મહિલા પશુપાલક શ્રીમતી શીલાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત આ દિવસે રંગોળી હરીફાઈ તેમજ શુસોભન હેતુ વેસ્ટ માંથી બેસ્ટ તૈયાર કરવાની હરીફાઈ યોજવામાં આવેલ જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર કરી સ્ટેજ પરના આમંત્રિતો દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવેલ.

કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી ડો. જી.જી.પટેલ દ્વારા સર્વેનું શાબ્દિક તથા પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ પ્રસંગોચિત્ત ઉદબોધન કરવામાં આવ્યું જેમાં તેઓએ ધરતી માતા અને માતાઓની નવસર્જન કરવાની માતૃશક્તિ ને નમન કરી, કૃષિમાં મહિલાઓનો ફાળો, તેમની અગત્યતા તેમજ મહિલાઓની કોઠા સૂઝ દ્વારા પરિવારની આવક વધારવામાં આગવા પ્રદાન બાબતે ચર્ચા કરી. ત્યારબાદ પ્રગતિશીલ મહિલા પશુપાલક શ્રીમતી શીલાબેન પટેલ, ગામ- ગાડા દ્વારા મહિલા સશક્તિકરણ અન્વયે તેમની સફળગાથા જણાવી જેમાં તેઓએ બહેનો પોતાના કુટુંબની પશુપાલન થકી આવક વધારવા બાબતે ચર્ચા કરી હતી. પ્રગતિશીલ મહિલા ખેડૂત શ્રીમતી સગુણાબેન પટેલ, ગામ- ઇસરામા દ્વારા મહિલાઓ બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન તેમજ ધરુ ઉછેર થકી આર્થિક ઉપાર્જન મેળવી શકે તથા ક્રિયન ગાર્ડન દ્વારા ઘર આંગણે રસાયણમુક્ત શાકભાજી મેળવી શકાય તે બાબતે જણાવ્યું. તેમજ મહિલાઓએ પ્રસંગને અનુરૂપ પોતાના અનુભવો વ્યક્ત કર્યા. સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ શ્રી ભરતભાઈ જોગરાણા, મામલતદારશ્રી ના પ્રતિનિધી, સોજીત્રા, એ મહિલાઓને મતદાન માટેની જાગૃતતા અને મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધાવે તે વિષે ચર્ચા કરી.

અંતે ડો. આર.એમ. પટેલ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ), કેવિકે, દેવાતજ દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી. ભોજન વિરામ બાદ સર્વે બહેનોએ ફળ, ફૂલ, શાકભાજી તથા મસાલા પાકોમાં મૂલ્યવર્ધીત બનાવટોનું કૃષિ પ્રદર્શન નિહાળ્યું. કાર્યક્રમનું આયોજન તેમજ સફળ સંચાલન શ્રીમતી અંજલી એન. જાદવ, પ્રોગ્રામ આસી.(ગૃ.વિ.), તેમજ કેવિકેની મહિલા ટીમ દ્વારા કરવામાં આવેલ.

“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઝાંખીઓ



પ્રસંગીયીત ઉદબોધન



કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનો



હરીફાઇનુ મુલ્યાંકન



રંગોળી હરીફાઇ



ઇનામ વિતરણ



ફષિ પ્રદર્શન